

જનસંપર્ક અધીકારી દ્વારા
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩
કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૦૩/૦૮/૨૦૧૭ રવિવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી ધારા હેઠળ ઝડપાયા :-

સમાચાર યાદી નં.૧૭૭૬/૧૭

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૩૧ કેસ કરી, ૩૨ વ્યક્તિઓને ઝડપી, ૨૦૧ લીટર દેશી દારૂ, ૭ બોટલ ઇંગ્લીશ દારૂ અને ૨ સ્કુટર કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૭૭૭/૧૭

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૮,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૬૭ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી ૯૩ મુજબ ૪ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

છેતરપીડીની ફરીયાદ:-

સમાચાર યાદી નં.૧૭૭૮/૧૭

સોલા હાઈકોર્ટ: પ્રકાશ સોહનલાલ શર્મા (રહે. ભાવિકનગર આદિનાથનગર ઓઢવ) એ તા.૨/૮/૧૭ નારોજ સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે સોલા બ્રીજ નજીક ઓટો માર્ક્સ મોટર્સ પ્રાઇવેટ લીમીટેડ પ્લોટ નં-૨૦૬ ખાતે તા.૭/૧૧/૨૦૧૬ થી તા.૧૦/૮/૨૦૧૭ સુધીના સમયગાળા દરમ્યાન આરોપી મિલન રણજીતકુમાર જોષી (રહે.શિવમ એપાર્ટમેન્ટ ઇસનપુર) ઓટો માર્ક્સ મોટર્સ પ્રાઇવેટ લીમીટેડ કંપનીમા રીસેપ્શન આર.ટી.ઓ. એક્ઝીક્યુટીવ તરીકે નોકરી કરતા હોઈ કંપનીમાંથી ખરીદ કરેલ કારના ગ્રાહકો પાસેથી ચોઇસ નંબર તથા આર.ટી.ઓ.ના નાણાં મેળવી રીસીપ્ટ નહી આપી અને મેળવેલ નાણાં આર.ટી.ઓ.મા જમાં નહી કરાવી ગ્રાહકો તથા કંપની સાથે રૂપિયા ૩,૦૦,૦૦૦/- વિશ્વાસઘાત અને છેતરપીડી કરી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી જે.આર.ભાયકન ચલાવે છે.

ડુબી જતાં મૃત્યુ:

સમાચાર યાદી નં.૧૭૭૯/૧૭

રીવરફ્રન્ટ ઇસ્ટ: રોહીત ધર્મેશભાઈ વાઘેલા (ઉ.વ.૧૫) (રહે. વેલજીભાઈનો કુવો રામાપીરની ચાલી મોટેરા) તા.૨/૮/૧૭ બપોરના ૧/૪૫ વાગ્યાના સુમારે કોટેશ્વર સાબરમતી નદીમાં નહાવા જતા પગ લપસી જતા પાણીમાં ડુબી જતા મૃત્યુ નિપજયું હતુઆ અંગે રીવરફ્રન્ટ ઇસ્ટ પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ હે.કો.શ્રી મોતીભાઈ તળજાભાઈ ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.